

ખાસ અગત્યનું

૨ પરિપત્ર ૨

વિષય:- બુકએડજસ્ટમેન્ટની પદ્ધતિ રદ કરવા બાબત....

નવસારી કૃષિ યુનિવર્સિટીના તમામ કચેરી અને યોજનાઓના વડાશ્રીઓ, નિયંત્રણ અધિકારીશ્રીઓ તેમજ ઉપાડ અને ચુકવણા અધિકારીશ્રીઓને જણાવવાનું કે, હાલમાં યુનિવર્સિટી હસ્તકની જુદીજુદી કચેરીઓ પાસે કોઈપણ પ્રકારની ચીજવસ્તુઓ/ ખેતપેદાશો/ સેવાઓ ખરીદવા માટે જે તે કચેરીથી નમુનો "અ" મુજબની માંગણીના આધારે ચીજવસ્તુઓ/ ખેતપેદાશો/ સેવાઓ પૂરી પાડનાર કચેરી દ્વારા ઉધારબીલ સાથે નમુનો "બ" ઈશ્યુ કરવામાં આવે છે અને જે તે કચેરી દ્વારા ગ્રાન્ટ ભરી નમુનો "બ" સાથે ઉધારબીલ અત્રેની કચેરીની તિખેરી શાખામાં રજુ કરવામાં આવતા તિખેરી શાખા દ્વારા નમુનો "ક" ઈશ્યુ કરી ખર્ચ અને આવક જે તે કચેરીના બજેટ સદરે સરભર કરવામાં આવે છે. અનુભવે જણાયેલ છે કે, જે તે કચેરી દ્વારા ચીજવસ્તુઓ/ ખેતપેદાશો/ સેવાઓની ખરીદી માટેની માંગણી મુજબ ખરીદીનું ઉધારબીલ અને નમુનો "બ" ઈશ્યુ કર્યા પછી સંબંધીત કચેરી દ્વારા કોઈ કાર્યવાહી ન થવાને કારણે ખર્ચ-આવકનો હવાલો નાંખી શકાતો નથી. જેથી ઓડિટના પ્રશ્નો ઉપરિચિત થાય છે. જે અન્વયે સર્વેને જણાવવાનું કે, **તા. ૦૧/૦૪/૨૦૨૨** થી અત્રેની યુનિવર્સિટીમાં તમામ પ્રકારના ખર્ચ-આવકના **બુકએડજસ્ટમેન્ટની પદ્ધતિ રદ કરવામાં આવે છે. જેની ખાસ નોંધ લેવી.**

હાલમાં નવસારી કૃષિ યુનિવર્સિટી હસ્તકની કચેરી દ્વારા તમામ બીલોનાં નાણાંકીય વ્યવહારો માટે ડીડીઓનાં બેંક ખાતા ખોલાવવામાં આવેલ છે, જેથી જ્યારે પણ યુનિવર્સિટી હસ્તકની જુદીજુદી કચેરીઓ દ્વારા અંદરોઅંદર કોઈપણ પ્રકારની ચીજવસ્તુઓ/ ખેતપેદાશો/ સેવાઓ ખરીદવાની થાય ત્યારે જે તે કચેરી પાસેથી ઉધારબીલ મેળવી **બુકએડજસ્ટમેન્ટની દરખાસ્ત ન કરતા** નિતિ નિયમો મુજબ ખરીદી કરી તિખેરી શાખામાં પાર્સિંગ અર્થે બીલ રજુ કરી બેંક ખાતા મારફત જે તે કચેરીને પેમેન્ટ કરવાની પ્રથા અપનાવવા જણાવવામાં આવે છે.

ઉપરોક્ત પરિપત્ર નાણાંકીય વ્યવહારોનું વ્યવસ્થાપન સારી રીતે થઈ શકે તે અર્થે બહાર પાડવામાં આવે છે.

સદરહું પરિપત્ર માન. કુલપતિશ્રીની મંજૂરી મેળવીને પ્રસિદ્ધ કરવામાં આવે છે.

ખ.નં. નકૃયુ/હિનિ/વવહિઅ/બી.૩/૧૯૪૩/૨૦૨૨
નવસારી, તા. ૧૧/૦૩/૨૦૨૨



હિસાબ નિયામક

નકલ સવિનય રવાના:-

- (૧) અત્રેની યુનિવર્સિટીના તમામ કચેરી અને યોજનાઓના વડાશ્રીઓ તરફ જાણ સારૂ.
- (૨) અત્રેની યુનિવર્સિટીના તમામ યોજનાઓના નિયંત્રણ અધિકારીશ્રીઓ તરફ જાણ સારૂ.
- (૩) અત્રેની યુનિવર્સિટીના તમામ ઉપાડ અને ચુકવણા અધિકારીશ્રીઓ તરફ જાણ સારૂ.
- (૪) માન. કુલપતિશ્રીના રહસ્ય સચિવશ્રી, ન. કૃ. યુ., નવસારી તરફ જાણ તથા અમલ થવા સારૂ.

નકલ રવાના:-

વહીવટી-વ-હિસાબી અધિકારી, ન. કૃ. યુ., નવસારી તરફ જાણ તથા અમલ થવા સારૂ.

